



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૫/૦૬/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૧૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૪૩૧ લીટર દેશી દારૂ, ૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૮૫ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૨૦ બિયર ટીન અને ૧ માણી વાન કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૫,૬૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૨૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૪ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૨૧/૧૯

ગાયકવાડ હવેલી : શફીમોહમ્મદ ઇકબાલભાઈ ખેડાવાલા (ઉ.વ.૩૩)(રહે.માસ્ટર મંજીલ રાવળીયા વાસ ઇસ્માઇલ પીરની દરગાહની સામે જમાલપુર) એ તા.૧૪/૬/૧૯ નારોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૮/૨૦૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આસ્ટોડીયા રોડ ગોળલીમડા અંજુમન હાઇસ્કૂલની સામે આવેલ એસ.એસ.ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે આરોપી (૧) સરફરાજખાન મહેબુબખાન પઠાણ (રહે.અલશીલા કોર્ટ ફ્રેઝાન મદીના લલ્લુ રાયજીનો વંડો મિરઝાપુર) તથા તેના બે મિત્રો મુબીનુદ્દિન તથા અમીન સૈયદ નાઓએ ભેગામળી શફીભાઈ ને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૮૯,૯૭૫/- તથા માલસામાન મેળવી લઈ તેમજ ટીકીટો બનાવડાવી તે પેટે કોઈ નાણા પરત નહી ચુકવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એન.એસ.રાઠોડ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયો :

સમાચાર યાદી નં.૧૦૨૨/૧૯

સોલા હાઇકોર્ટ : સુશીલાબેન વા/ઓ પ્રભુદાસ પટેલ (ઉ.વ.૫૮)(રહે.પારસમણી એપાર્ટમેન્ટ, શાલીગ્રામ બંજ્લોઝ-૦૩ ની સામે, એવલોન હોટલ રોડ, થલતેજ) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૪/૦૬/૨૦૧૯ સવારના ૬/૩૦ વાગ્યાના સુમારે એવલોન હોટલ રોડ પરથી પારસમણી એપાર્ટમેન્ટ તરફ વળાંક પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન મોટર સાયકલ ઉપર આવેલ પુરૂષ સુશીલાબેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ નાસી ગયો છે આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.આર.ગઢવી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૦૨૩/૧૯

**એલીસબ્રીજ :** આશીષભાઈ પ્રહલાદભાઈ પટેલ (ઉ.વ.૨૧)(રહે.ત્રીજા માળે એન.એચ.એલ. બોયસ હોસ્ટેલ પ્રીતમનગર નો પહેલો ઢાળ સીકાગો હોટલની સામે એલીસબ્રીજ) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૦૬/૨૦૧૯ ના કલાક ૧૧/૩૦ થી તા.૧૨/૦૬/૨૦૧૯ ના કલાક ૭/૦૦ વાગ્યા દરમ્યાન એલીસબ્રીજ કોંગ્રેસ ભવનની પાછળ એન.એચ.એલ.હોસ્ટેલના રૂમમાંથી (૧) આસુસ કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- (૨)એપલ કંપનીનું મેકબુક કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તથા (૩)વન પ્લસ કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૦,૦૦૦/- મતાની કોઈ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જી.ખાંભલા ચલાવે છે.

**એલીસબ્રીજ :** વર્ષાનભાઈ નયનભાઈ શાહ (ઉ.વ.૩૭)(રહે.શ્રીનીવાસ સોસાયટી અનુજા બંગ્લાની સામે નવા વિકાસગૃહ રોડ પાલડી) એ તા.૧૪/૦૬/૧૯ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૫/૨૦૧૯ થી તા.૧૦/૦૬/૨૦૧૯ દરમ્યાન આશ્રમ રોડ ચીનુભાઈ સેન્ટરમાં ૮ મા માળે આવેલ પોતાની “દેવ સેલ્સ” નામની ઓફીસમાં નોકરી કરતો આરોપી અંકીતભાઈ પંકજભાઈ રાઠોડ (રહે.તેજવીરપાર્ક એસ.ટી.વર્ક શોપની પાસે દાણીલીમડા) એ ઓફીસમાંથી કેશીયો કંપનીની ઘડીયાળ નંગ-૧૧૬ કિંમત રૂપિયા ૮,૪૮,૮૨૦/- મતાની ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જી.ખાંભલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૨૪/૧૯

**વાસણા :** વૈશલ ભદ્રેશભાઈ શાહ (ઉ.વ.૩૫)(રહે.મનમંદીર ફ્લેટ પુરોહીત ચવાણા પાસે નારાયણનગર વાસણા) એ કોઈ અગમ્ય કારણસર તા.૧૪/૦૬/૨૦૧૯ ના કલાક ૯/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પોતાની જાતે ઝેરી પ્રવાહી પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.આર.સુર્યવંશી ચલાવે છે.

**કૃષ્ણનગર :** દિક્ષીતાબેન વા/ઓ સંકેતભાઈ ગૌસ્વામી (ઉ.વ.૨૫)(રહે.શ્યામ-૧૮ ફ્લેટ, બહુચર માતાના મંદીર પાસે નિકોલ રોડ, નવા નરોડા) એ કોઈ અગમ્ય કારણસર તા.૧૩/૦૬/૨૦૧૯ સાંજના ૭/૦૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે સિલીંગ ના હુક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એ.આર.બાથમ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.